


2012
International
Year of



Cooperatives

COOPERATIVE ENTERPRISES BUILD A BETTER WORLD

પરિપત્ર ક્રમાંક:૧૪/૨૦૧૨
ક્રમાંક: જીયુસીબીએફ/૩૭/૧૦૩૨

તા.૧૫/૦૩/૨૦૧૨.

પ્રતિ,
ચેરમેનશ્રી/જનરલ મેનેજરશ્રી/મેનેજરશ્રી,
તમામ સભાસદ નાગરિક સહકારી બેન્કો

વિષય:- કીપોઝીટના વ્યાજ પર TDS કાપવા બાબત.

માનનીયશ્રી,

સચિનય જણાવવાનું કે ફેડરેશનના તા.૦૬/૦૩/૨૦૧૨ના પરિપત્ર ક્રમાંક:૧૨ /૨૦૧૨ અન્વયે નાગરિક સહકારી બેન્કો દ્વારા ટાઈમ કીપોઝીટ ઉપર ચુકવવામાં આવતા વ્યાજ માંથી આવકવેરા કાયદાની જોગવાઈ મુજબ TDS કાપવામાં આવતો નથી. જે પરિપત્રમાં જણાવેલ વિગતે કાપવા બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.

પરંતુ ઉપરોક્ત બાબતે જલગૌંવ કીસ્ક્રીકટ કો-ઓપરેટીવ બેન્ક લી., જલગૌંવના કેસમાં મુંબઈ હાઈકોર્ટ અને નામદાર સુપ્રિમ કોર્ટના ચૂકાદા મુજબ નાગરિક સહકારી બેન્કોના સભાસદો/નોમીનલ સભાસદોના ટાઈમ કીપોઝીટ ઉપરના રૂ.૧૦,૦૦૦/-થી ઉપરના વ્યાજમાંથી TDS કાપવાનો રહેતો નથી. આ સાથે ઈન્ડિયન બેન્ક એસોસીએશન તરફથી મળેલ તા.૦૫/૦૮/૨૦૦૪ના પત્રની ઝેરોક્સ નકલ સામેલ રાખી મોકલેલ છે. જે વિદીત થાય.

સહકાર બદલ આભાર,

આપનો વિશ્વાસુ

(શ. કે. ફકીર)

ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર

D:\૨૦૦૪-૦૫\Word\Gujarati\Paripatra-૨૦૧૨.doc-૧૭



GUJARAT URBAN CO-OPERATIVE BANKS FEDERATION



Co-operative Banks Bhavan, Near Jaihind Press, Ashram Road, Mithakhali Under Bridge, Ahmedabad-380 009.
Phone : 079 - 26590150, 26590170 Fax : 079 - 26584901 E-mail : guifed@gmail.com. Web : www.guifed.com

Indian Banks' Association

No. OPR/10-42(7)/ 264 J

November 05, 2004

To

The Chief Executives of all Co-operative Member Banks

Dear Sirs,

Supreme Court decision on Interest on deposits – Not to deduct the TDS

In the case of Jalgaon District Co-op. Bank Ltd. Vs. Union of India. The Bombay High Court was concerned with the question as to whether the exemption granted to co-operative society under section 194A(3)(v) of the act can be taken away by creating distinction between a duly registered member and a nominal member. The Bombay High Court held that section 194A(3) does not contemplate such a distinction. The Hon'ble Supreme Court has rejected the special leave petition filed against the aforesaid Bombay High Court decision. A copy of the Order dated 9th July 2004 is enclosed.

As stated above section 194A(3)(v) does not contemplate any distinction between members of Co-operative Society, as such TDS is not to be deducted u/s.194A(3)(V) of the I T Act 1961 from interest paid to nominal members.

Members are requested to take note of the above.

Yours faithfully,



N G Kamath
Vice President [Taxation & Compliance]

Encl.